



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૪/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૯૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૬ કેસ કરી, ૫૯ વ્યક્તિઓને ઝડપી, ૨૨૪ લીટર દેશી દારૂ, ૩ બોટલ ઇંગ્લીશ દારૂ, ૧ સ્કુટર અને ૧ ઓટોરીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૫૯૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૧૭૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૯૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ :-

સમાચાર યાદી નં.૬૦૦/૧૯

**એલીસબ્રીજ:** ભુરાભાઈ મોહનભાઈ દેસાઈ (ઉ.વ.૫૧)(રહે,રબારીવાસ, શિવશક્તિનગર સેલ પેટ્રોલ પમ્પની બાજુમાં, ગુપ્તાનગર) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૪/૧૯ સવારના ૫/૦૦ વાગ્યાના સુમારે વા.સા.હોસ્પિટલના પાછળના દરવાજા નજીકથી પોતાનો પુત્ર લાલજીભાઈ ભુરાભાઈ દેસાઈ (ઉ.વ.૧૭) પસાર થઈ રહ્યો હતો દરમિયાન એક ઓટોરીક્ષામાં આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરૂષો લાલજીભાઈને છરી બતાવી લાલજીભાઈના ગળામાં પહેરેલ સોનાની ચેઇન, હાથની સોનાની વીટી, એક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા ૮,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૦,૦૦૦/- લુંટ કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી.વિહોલ ચલાવે છે.

**રખિયાલ:** લક્ષ્મીબહેન વા/ઓ નરોત્તમભાઈ રોહીત (ઉ.વ.૫૦) (રહે.સત્યમ એપાર્ટમેન્ટ રખિયાલ રોડ રખિયાલ) એ તા.૩/૪/૧૯ નારોજ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૩/૧૯ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે રખિયાલ ડાયનાસોર સર્કલની બાજુમાં આવેલ ગવર્મેન્ટ ક્વાર્ટર્સના ગેટ સામેથી એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક્ટીવા ઉપર આવેલ પુરૂષ લક્ષ્મીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.આઇ.પટેલ ચલાવે છે.

**ઓઢવ:** શિવકુમાર રામદયાલ નરાનીવાલ (ઉ.વ.૪૬)(રહે.સમરથ એવન્યુ ગીરીવર હોમ્સની બાજુમાં માધવ સ્કુલ રોડ વસ્ત્રાલ)એ તા.૩/૪/૧૯ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૩/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે ઓઢવ તક્ષશીલા સ્કુલની ગેટ નં-૨ આગળથી પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) બે પુરૂષ શિવકુમારની પત્નીના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.ચૌહાણ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૬૦૧/૧૯

શાહપુર: મોહમદયુસુફ હાજીનિઝામુદ્દીન લુહાર (રહે. મોતી બેકરીની પાછળ રંગા અવધુત સોસાયટી સરખેજ રોડ, સરખેજ) એ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૦૨/૦૪/૧૯ રાતના ૯/૦૦ થી તા.૦૩/૦૪/૧૯ કલાક ૯/૩૦ વાગ્યા દરમ્યાન મિરઝાપુર ત્રણ ખુણીયા બગીચા પાસે એસ.એસ.કાર એસેસરીઝ નામની દુકાનના ઉપરના માળે પતરાના શેડનું પતરુ કાપી, અજાણી વ્યક્તિ દુકાનના કાઉન્ટરમાંથી રોકડ રૂપિયા ૪૫,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.આર.બલાત ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૬૦૨/૧૯

સાબરમતી: તુલસીબહેન વા/ઓ બાબુભાઈ બરંડા (ઉ.વ.૫૮)(રહે.પ્રમુખ બંગ્લોઝ ન્યુ રાણીપ સાબરમતી) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૪/૧૯ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી અતુલકુમાર કાંતીભાઈ ચલાવે છે.

ચાંદખેડા: આનંદભાઈ ચંદુલાલ ત્રિવેદી (ઉ.વ.૪૩) (રહે. સેતુ સ્કારલેટ ફ્લેટ વિસત ગાંધીનગર હાઇવે ચાંદખેડા) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૪/૧૯ બપોરના ૧/૩૦ થી ૪/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રવિણભાઈ જયંતીભાઈ ચલાવે છે.

રામોલ: પ્રદીપભાઈ ગીરીશભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) (રહે. ઔડાના મકાન મેથોડીક ચર્ચ પાછળ સી.ટી.એમ રામોલ) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૪/૧૯ કલાક ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ભીખુભાઈ ભલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.